

વાર્ષિક પરીક્ષા : ૨૦૨૦

વિષય : શારીરિક શિક્ષણ

ઘોરણ : ૩

કુલ ગુણ : ૨૫

- યૌગિક ક્રિયાઓ અને સરળ આસનો ઉત્સાહ પૂર્વક કરે છે.
- સાંધિક રમતો કૌશલ્યપૂર્વક રમે છે.
- ખેલકૂદ અને જિમ્નાસ્ટિક ગતિમેળ અને લયબદ્ધ કરે છે.
- સર્વાંગ સુંદર વ્યાયામ કરે છે.

- (૧) પ્રાર્થના સભા દરમિયાન કરવામાં આવતા યોગાસનોમાંથી કોઈ પણ બે યોગાસન કરો. (૧૦)
- (૨) કસરતના કોઈ પણ બે દાવ કરો. (૧૦)
- (૩) ૫૦ મીટર દોડ દોડાવવી. (૫)

વિષય : ચિત્ર

ઘોરણ : ૩

કુલ ગુણ : ૨૫

- ચિત્રમાં રેખાંકન સ્પષ્ટ અને સુંદર કરે છે.
- ચિત્રમાં રંગપૂરણી સારી રીતે કરે છે.

- (૧) કોઈ પણ એક પ્રાણી અથવા પક્ષીનું ચિત્ર દોરી રંગપૂરણી કરો. (૧૫)
- (૨) કોઈ પણ એક ફળ અથવા શાકભાજીનું ચિત્ર દોરી રંગપૂરણી કરો. (૧૦)

વિષય : સંગીત / કાર્યાનુભવ

ઘોરણ : ૩

સંગીત : ૨૫

કાર્યાનુભવ : ૨૫

- ગાન / વાદન (અભિનય, બાળગીત વગેરે)
- નાટ્ય, નૃત્ય, વેશભૂષા, અભિનય કરે છે.
- ઈકો કલબની પ્રવૃત્તિ કરે છે.
- માટીકામ, કાગળકામ, શાળા સુશોભન કરે છે.

- (૧) કોઈ પણ એક બાળગીતનું ગાન અથવા અભિનય ગીત કરો. (૧૫)
- (૨) તમને આવડતું કોઈ એક ભજન અથવા ગીતનું ગાન કરો. (૧૦)
- (૩) માટીમાંથી રમકડાં બનાવવા. (૧૫)
- (૪) કાગળમાંથી પોસ્ટકાર્ડ બનાવવું. (૧૦)

વાર્ષિક પરીક્ષા : ૨૦૨૦

વિષય : શારીરિક શિક્ષણ

ઘોરણ : ૪

કુલ ગુણ : ૨૫

- યૌગિક ક્રિયાઓ અને સરળ આસનો ઉત્સાહ પૂર્વક કરે છે.
- સાંધિક રમતો કૌશલ્યપૂર્વક રમે છે.
- ખેલકૂદ અને જિમ્નાસ્ટિક ગતિમેળ અને લયબદ્ધ કરે છે.
- સર્વાંગ સુંદર વ્યાયામ કરે છે.

- (૧) કોઈ પણ બે યોગાસન કરો. (૧૦)
- (૨) કસરતના કોઈ પણ બે દાવ કરો. (૧૦)
- (૩) ૧૦૦ મીટર દોડ દોડાવવી. (૫)

વિષય : ચિત્ર

ઘોરણ : ૪

કુલ ગુણ : ૨૫

- ચિત્રમાં રેખાંકન સ્પષ્ટ અને સુંદર કરે છે.
- ચિત્રમાં રંગપૂરણી સારી રીતે કરે છે.

- (૧) કોઈ પણ એક પ્રાણીનું ચિત્ર દોરી રંગપૂરણી કરો. (૧૫)
- (૨) રાષ્ટ્રધ્વજનું ચિત્ર દોરી રંગપૂરણી કરો. (૧૦)

વિષય : સંગીત / કાર્યાનુભવ

ઘોરણ : ૪

સંગીત : ૨૫

કાર્યાનુભવ : ૨૫

- ગાન / વાદન (અભિનય, બાળગીત વગેરે)
- નાટ્ય, નૃત્ય, વેશભૂષા, અભિનય કરે છે.
- ઈકો કલબની પ્રવૃત્તિ કરે છે.
- માટીકામ, કાગળકામ, શાળા સુશોભન કરે છે.

- (૧) કોઈ પણ એક બાળગીતનું ગાન અથવા અભિનય ગીત કરો. (૧૫)
- (૨) તમને આવડતું કોઈ એક ભજન અથવા કાવ્યનું ગાન કરો. (૧૦)
- (૩) નકામા ખોખામાંથી પક્ષી ઘર બનાવવું. (૧૫)
- (૪) કાગળમાંથી વિમાન અને હોડી બનાવવી. (૧૦)

વાર્ષિક પરીક્ષા : ૨૦૨૦

વિષય : શારીરિક શિક્ષણ

ધોરણ : ૫

કુલ ગુણ : ૨૫

- યૌગિક ક્રિયાઓ અને સરળ આસનો ઉત્સાહ પૂર્વક કરે છે.
- સાંધિક રમતો કૌશલ્યપૂર્વક રમે છે.
- ખેલકૂદ અને જિમ્નાસ્ટિક ગતિમેળ અને લયબદ્ધ કરે છે.
- સર્વાંગ સુંદર વ્યાયામ કરે છે.

(૧) નીચેનામાંથી કોઈપણ બે યોગાસન કરો. (૧૦)

(વજાસન, હસ્તપાદાસન, તાડાસન, ભુજંગાસન, વૃક્ષાસન, શવાસન)

(૨) બેઠકની કસરતના કોઈ પણ બે દાવ કરો. (૧૦)

(૩) ગોળા ફેંકની રમત રમાડવી. (૫)

વિષય : ચિત્ર

ધોરણ : ૫

કુલ ગુણ : ૨૫

- ચિત્રમાં રેખાંકન સ્પષ્ટ અને સુંદર કરે છે.
- ચિત્રમાં રંગપૂરણી સારી રીતે કરે છે.

(૧) વર્તુળ અથવા ચોરસમાં ડિઝાઈન દોરી રંગપૂરણી કરો. (૧૫)

(૨) 'મેરા ભારત મહાન' અક્ષર લેખન કરી રંગપૂરણી કરો. (૧૦)

વિષય : સંગીત / કાર્યાનુભવ

ધોરણ : ૫

સંગીત : ૨૫

કાર્યાનુભવ : ૨૫

- ગાન / વાદન (અભિનય, બાળગીત વગેરે)
- નાટ્ય, નૃત્ય, વેશભૂષા, અભિનય કરે છે.
- ઈકો કલબની પ્રવૃત્તિ કરે છે.
- માટીકામ, કાગળકામ, શાળા સુશોભન કરે છે.

(૧) કોઈ પણ એક બાળગીતનું ગાન અથવા અભિનય ગીત કરો. (૧૫)

(૨) તમને આવડતું ભજન , શ્લોક, કાવ્ય, રાષ્ટ્રગીતનું ગાન કરો. (ગમે તે એક) (૧૦)

(૩) નકામા ખોખામાંથી ઘર બનાવવું. (૧૫)

(૪) કાગળમાંથી ફરકડી બનાવવી. (૧૦)